

ધા અતી મદદ

: લેખક :

અલ્લામા નસીરુદ્દીન 'નસીર' હુંડ્રેડ

: અનુવાદક :

અકબર હંદીલ રાજન

: પ્રકાશક :

ખાનએ હિકમત-ઈંડારાએ 'આરિફ'

પા અલી મદ્દ

: લેખક :

અધ્યાત્મા નસીરુદ્દીન ‘નસીર’ હુંગાઈ

: અનુવાદક :

અક્ષય હળીબ રાજન

Institute for
Spiritual Wisdom
and
Luminous Science

Knowledge for a united humanity

: પ્રકાશક :

ખાનએ હિકમત-ઇંડારાએ ‘આરિઝ’
3-એ, નૂર વીલા, ગાડન વેસ્ટ
કરાચી (પાકિસ્તાન)

ઈલમી લેટ

ઇંડારાએ આરીઝ અમેરિકા

ની

શાખાના ઓડીયો વીજયુભલના

ઈન્ચાર્જ

અંદુલ મજૂદ પંજવાસું

અને

તેમના વિનમ્ર કુટુંબીઓના મારફત

ગૂરે-ઈલમ એટલે કે શાનના પ્રકાશના

પરવાનાઓ માટે

Luminous Science

Knowledge for a united humanity

૫૧ અલી મદ્દ

મદ્દનો અર્થ : દલીલ ૧ :

જેમકે આ પુસ્તિકામાં છેકેકાગે એ ઈરારો કરવામાં આવ્યો છે કે (મખ્લુક્ને) આ જગતમાં થયેલ સર્જનને હકીકી મદ્દ ખુદા તરફથી પ્રાપ્ત થાય છે, પણ તે (મદ્દ) રસૂલ (સ.અ.સ.) અને ઈમામ (અ.સ.)ના કારણે, (તેમના મારક્ષત અથવા તેમના સંબંધે) શક્તય છે. તેના પછી (બીજા નંબરે) જાહેરી મિજાજી (એટલે કે ઉપમાવાળી-માયાવી) અને જીસ્માની એટલે કે શારીરિક મદ્દ છે, (એ મદ્દ) કે જે લોકોના તરફથી (જગતના માનવીઓના તરફથી) ખુદા, પયગમ્બર અને ઈમામ (અ.સ.)ને (માટે) હેવી જોઈએ, જેનો અર્થ એમ થયો કે મદ્દ મુકામ એટસે સ્થાન અને દરજજા પ્રમાણેની હોય છે, એટલે કે ખુદાની મદ્દ, પયગમ્બર (અ.સ.) અને ઈમામ (અ.સ.)ની મદ્દ અને લોકોની મદ્દ એક જેવી નથી થઈ શક્તી, અર્થાત તે મદ્દ તેના દરજજા મુજબની, શક્તિ પ્રમાણેની હોઈ શકે છે, માટે ‘યા અલી મદ્દ’નો અર્થ છે કે “અય અલી (અ.સ.) સિરાને મુસ્તકીમ (સીધા રસ્તા) ઉપર અમારું માર્ગદર્શન કરો; અને અમારો હાથ જાલી લ્યો,” કારણ કે અહી મદ્દનો હેતુ જાહેરી અને બાનિની માર્ગદર્શન (ભિંડાપત)ના

તેમ છાં પણ જો પૂર્ખવામાં આવે કે આપણે “યા અક્ષાહ મદ્દ” તેમ ન કહીએ અને “યા રસૂલ (સ.અ.સ.) મદ્દ” કહીએ અને “યા અલી મદ્દ” કહીએ ? આનો વિગતવાર જવાબ નીચે જગ્યાવ્યા મુજબ છે :

૧. જેમની એ માન્યતા છે, બલ્કે ઈમાન છે—જેમને એ બાબત વિશ્વાસ છે—કે પયગમ્બર અને ઈમામ (અ.સ.) ખુદા તથાલાના જ્યવંત અને બોલનારા (ઈસ્મે આઝમ) મહાન નામો છે (૭ : ૧૮૦) તેમના માટે આ વાત હક (સાચી) અને હકીકત (સત્ય) છે કે તેઓ ખુદાને—અક્ષાહ તથાલાને—એવા નામથી સાદ કરે (પોકરે) કે જે સૌથી મહાન અને ખુદાવંદ તથાલાને ખૂલ્ય જ પ્રિય અને વહાલું છે.

૨. અક્ષાહવાળાઓ—જ્ઞાનીઓના માટે એ વાત ઘણું મોટી મહત્વતાવાળી છે કે હક તથાલાએ જ્યારેય પોતાના બ્રેઇ જહેરી અને અક્ષરી નામને પોતાનો ખલીશ નથી બનાવ્યો, નામને પયગમ્બર કે ઈમામ નથી ગણ્યાયો, તેને (નામને) આસમાની પુસ્તકનું જ્ઞાન શીખવનાર (શિક્ષક) નથી કહ્યો, એમ નથી કૃમાયું કે છિદ્યતના નૂરનું મૂળ જ-ઉદ્ભવસ્થાન જ-શાબ્દિક નામ છે, અને ન તો એમ કૃમાવવામાં આવ્યું છે કે જહેરી નામ ખુદાની રસ્સી છે, તો એ જગ્યાયું કે ખુદાનું હીકી નામ પયગમ્બર (અ.સ.) અને ઈમામે જમાન (અ.સ.) છે, માટે તેઓના જ માર્કન્ટ, (તેઓના જ સહારાથી) ખુદા તથાલાની તરફ હાજર થવું (રજૂ થવું) તે વ્યાજખી અને યોગ્ય છે.

3. શા માટે નહીં, ખુદાવંદ તરાલાના જહેરી અને અકારી નામોમાં પાગ મોમીનોના માટે નૂર જરૂર છે, પાગ તે ત્યારે કે જ્યારે નબી (અ.સ.) અથવા ઈમામ (અ.સ.) ક્રેદ ઉપર રાજી થઈ જાય, નહીં તો એ મુહેલ બલ્કે અશક્ય છે. દાખલા તરીકે ક્રેદ બિનમુસ્લિમને ખુદાવંદ તરાલાનું ક્રેદ જહેરી નામ દેખાડી છે અને કુરાનમાંથી રોધી આપો કે શું મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લમની નબુવ્યત અને રિસાલતને કબૂલ કર્યા વગર એવા એ શાખસને ખુદાના એ નામથી નૂર મળી શકે છે ? મને વિશ્વાસ છે કે કુરાનમાંથી આનો જવાબ નકારમાં મળશે.

4. જે પરિપૂર્ણ-સંપૂર્ણ માનવી એવો હોય કે તે આ ધર્તી ઉપર ખુદાનો ખલીશા-ખુદાનો પ્રતિનિધિ છે, તેના તરફથી હિદ્યાતતનું નૂર અને જ્ઞાન તથા હિક્મતના ભંડારો મળો છે, ખુદા અને તેના સર્જન (તેની માખુફ)ની વચ્ચે જે એક સંબંધ છે—એક રસ્તો છે અને જે લોકોને સાચવનાર-હાથ જાલનાર અને લોકોનો માર્ગદર્શક છે, તો એ જરૂરી બાબત છે કે લોકો દેશ વખતે તેની આગળ જ હાજર થાય અને તેને જ મદ્દ માટે સાદ દ્યે (પોકરે), કારગું કે ખુદાએ જ તેને (આ મકસદ) આ હેતુના માટે નિયુક્ત ફરમાવેલો છે.

5. કુરાન મજૂદની ઉચ્ચતા—મહાનતા તથા પવિત્રતા અને બરફન વિષે ક્રેદ મુસલમાનને શું રંકા હોઈ શકે છે ? માટે ખુદાના પુસ્તકનું જેટલું પાગ માન જાળવવામાં અને તેની જેટલી અદબ કરવામાં આવે તથા તેને જેટલું વારંવાર જોવામાં (વાંચવામાં) આવે તે સંઘળું વ્યાજબી અને યોગ્ય છે. એ જ

ઉપમા ઈમાનની પાગ છે અને તેમાં એક ક્રગ જેટલું પાગ
“શિર્ક” (શિર્ક એટલે ખુદને માનવામાં કોઈ અન્યને ભેળવવું)
નથી, કારગ કે ખુદ તાત્ત્વાલાની વસ્તુના સામે હાજર થવું એ
અસલમાં ખુદની સામે હાજર થવાનું છે, તો પછી તેમાં શિર્ક
કેમ થઈ શકે છે ?

૬. ખુદની ઓળખની કૃત્પનાઓમાંથી એક કૃત્પના
એવી પાગ છે કે જાગે હક સુભાન વ તાત્ત્વાલા યાને કે ખુદ,
અર્થ અજીવ ઉપર કાયમ થયો છે એટલે કે બેઠો છે; અને
જાગે કે તેના અર્થ એટલે કે તખત (ખુર્સી)ને અમુક મોટા
મોટા કુરિસ્તાઓએ ઉપાડેલ છે. જો આ વાત એક ઉપમા ન
હોય અને સત્ય હોય તો તે પછી પાગ તેનો એવો અર્થ થશે
કે તે ખૂલ જ શક્કિશાળી કુરિસ્તાઓ કે જેઓએ એ મહાન
તખત (અર્થ અજીવ)ને ઉપાડી રાખેલ છે, ખુદના શરીક (એ
વાત કે જેને ખુદ ક્ષેવાની આપણી માન્યતામાં ભેળવી હોવાય
તે) હરગીજ નથી, પરંતુ તે તો ખુદના બંદા છે, જોકે અર્થ
ઇલાહી એટલે કે ખુદાનું તખત તેઓના ઉપર કાયમ છે.

૭. ખુદાના લોહો-કલમ વિષેની એ કૃત્પના છે કે તે
ખુદાવંદ તાત્ત્વાલાનું સધળું કામ એ જ લોહ અને કલમે પૂર્ણ કર્યું
છે. પરંતુ કેમકે આ સધળું ખુદાના હુકમના પ્રમાણે થયું છે,
તેથી તે લોહ અને કલમ એ કઈ ખુદાના શરીક નથી, કારગ
કે ખુદાની પોતાની વસ્તુ ખુદાની શરીક નથી ક્ષેવાતી.

૮. ખુદાના (કુરિસ્તાઓ) જીબ્રાઈલ, મેકાઈલ, અસરાક્ષીલ
અને અગ્રાઈલ અતૌહિમુસ્સલામ છે કે જેઓ રૂહાનિયતનાં ઘણાં

બધાં કાર્યો પૂરાં કરે છે; અને તેમના સિવાય બીજા પાગ
અસંખ્ય ફરિથતાઓ છે કે જેઓ જુદાં જુદાં કાર્યો ઉપર નિયુક્ત
કરલા છે. તેઓ ખુદાવંદ તખાલાના હુકમથી કાર્યો કરે છે. આમ
રૂહ, રૂહનિયત અને ગૈબના (જે ન દેખાય તેવા) કામોને કરવા
બદલ તેઓ ખુદાના શરીક તો નથી કહેવતા ! !

૮. જાહેરી જગતનો પાગ એક દાખલો લઈએ કે સૂરજ
આ કાયનાત-ભલ્લાડમાં કેટલું મહાન કામ કરે છે કે આ જાહેરી
જગતની સંઘળી વ્યવસ્થા-સંઘળો કારખાર સૂર્ય ઉપર જ કાપમ
છે-(ચાલે છે-કામ કરે છે). એ જ પ્રમાણે જો દીનના જગતમાં
પાગ પોતાના પ્રકારનો એક સૂરજ હોય તો સ્પષ્ટ છે કે તે આ
જાહેરી દુનિયાના સૂરજ કસાં પાગ ઘાગે વધારે અજાયબી
ભરેલો હો, પાગ શું કોઈ વિદ્ધાન, કોઈ અક્ષલવાળો એ કહી શકે
છે કે તે દીની સૂરજ પોતે ખુદા છે અથવા તો તે ખુદાનો શરીક
છે ? જો દુનિયાનો (જાહેરી) સૂરજ પોતાના અનહુદ પ્રકારા તથા
ભૌતિક શક્તિઓ કે જેનાથી તે ભરપૂર છે, તે હોવા છાં
ખુદાનો શરીક નથી થઈ શકો, તો જાગૃતી લેવું જોઈએ કે દીની
જગતનો સૂરજ પાગ ખુદાનો શરીક કહેવડાવી નથી શકો, પાગ
ખુદાની કુદસને જાહેર કરનાર (માઝદર) હોઈ શકે છે. ખુદાનો
ખજાનો (ભંડાર) કહેવડાવી શકે છે અને છિદાયતનું
સાધન-છિદાયતનો માર્ગ-બની શકે છે. તો એ જાગૃતું જોઈએ
કે હજસત રસૂલ (સ.અ.સ.) અને ઠમામ (અ.સ.) દીની
જગતના સૂરજ અર્થાત નૂર છે અને તેઓથી છિદાયતનો પ્રકારા
મેળવવાના માટે તેમની સામે રજૂ થવું તેમને અરજ કર્યી એ

વ्याजबी (જાએજ) અને યોગ્ય છે અને તેમાં કેઈ રિક્ર નથી.

દીનના સુરૂજની અંદર પાક-પવિત્ર રૂહ અને સંપૂર્ણ અકલ છે. તેને (ઇલ્મો હિકમત) જ્ઞાન અને નેકી તથા હિદ્યાયતનું મૂળ (ઉત્પત્તિ સ્થાન) ગ્રાગાવવામાં આવેલ છે, તેમજ તેની સાથે સાથે (પરખરદિગારે) ખુદાએ તેમને શક્તિ (કુરૂત) આપી છે અને તેમને એ અધિકાર પ્રાપ્ત છે. તો આપણે જો એમ કહીએ કે “ઓ દીનના સૂર્ય, આપ અમોને દીનનો પ્રકાશ પહોંચાડો” તો શું એ રિક્ર થઈ શકે છે ? કેમ ? અને કેવી રીતે ?

(વાસ્તો અને વસીલો) કાશુગ અને સંબંધ (વાસ્તો અને અર્થ અથવા માર્ગ) : દલીલ ૨ :

એક રીતે મનુષ્યને હિદ્યાયત-માર્ગદર્શનની પ્રાપ્તિના માટે કેઈ પવિત્ર હસ્તીની જરૂરત હોય છે (તિ એવી કેઈ હસ્તીનો મોહતાજ હોય છે), કાશુગ કે તે પોતે સીધી રીતે (પોતાની મેળે) ખુદા સુધી પહોંચી તો નથી શક્તો, જેનો સાઝ-સ્યાં અર્થ એ છે કે તે (મનુષ્ય) પોતે જાતે ખુદાની પવિત્ર હિદ્યાયત સાંભળવા માટે અસર્મર્થ (અશક્ત) છે, અથવા કેઈ જાતના ખચકાટ વગર સાઝ સાઝ શબ્દોમાં એમ કહેવું જોઈએ કે તે (દિલ) હૃદયના કાનથી બહેરે છે, અને જે માગાસ બહેરે હોય છે તે પરિણામે મુંગો પાગ હોય છે, જેથી આવો માનવી ખુદા તથાલાને કેમ બોલાવી (પોકારી) શકે ? જ્યારે કે તેમાં (મનુષ્યમાં) તે જીસ નથી કે જે હેવી જોઈએ, તો પછી તેનું

પણ ગુણમાં એ આવ્યુ કે જોગે તેને મહાન અને સર્વ શક્તિમાન ખુદાની પવિત્ર છિદ્યાપત સંભળાવી હતી, તે જ હસ્તી તેની અરજ અને દુઅને પાગ (જેમની તેમ) પૂરેપૂરી ખુદા તથાલાની હુંગુરમાં રજૂ કરી શકે છે. આ જ કારણ છે કે જેથી પવિત્ર કુરાનમાં ફરમાવેલું છે કે : “અને (અય રસૂલ) જો તે લોકો તે જ વખતે જ્યારે કે તેમણે પોતાના જીવ ઉપર જુલમ કર્યો હતો, તમારી પાસે આવ્યા હોત, પદ્ધતી અક્ષાંખ તથાલા પાસેથી બજિસ માંગી હોત; અને રસૂલ પાગ તેઓના માટે બજિસની માંગાગી કરતે, તો તેઓ જરૂર ખુદા તથાલાને તૌબા કબૂલ કરનાર અને ઘાગે જ મહેરખાન પામ્યા હોત.” (૪ : ૬૪)

આ ફરમાન થકી એ જગ્યાય છે કે પયગભર સંખ્યમની પાસે જાહેરી રીતે આવે અથવા બાતિની પ્રકારથી તેના આગળ રજૂ થાય, દેખ સિથિતમાં એ દરખાસ્ત તો કર્યી જ પડ્યો કે “અય રસૂલુલ્લાહ (સ.અ.સ.) ! અમો ખુદા તથાલાના હુકમથી આપની પાસે—આપની સેવામાં આવ્યા છીએ, (અમારી દસ્તગીરી ફરમાવો) અમારો હાથ જાતી લ્યો અને અમારી મદ્દ કરો.” અને ‘‘યા અતી મદ્દ’’માં પાગ બસ્સ આવા જ પ્રકારનો અર્થ છે અને તેથી વધુ કંઈ નથી, જ્યારે કે મૌલા મુહીબીલ કુશા (મૌલા અલી) (અ.સ.) તો હજીત મુહમ્મદ (સ.અ.સ.)ના સાચા (જાનશિન) વારસદાર છે.

ઉપર જગ્યાવેલી આયત મુજબ ખુદાવેદ આલમીને જ્યારે એ હુકમ આપ્યો કે લોકો પોતાના ગુનાહેની (બક્ષામાગી) માઝી માટે પયગભર સંખ્યમની પાસે હાજર થાય; અને આપ

માનવંત સાહેબના માર્ક્ષત માર્કી (બજિસ) માંગ્યા કરે, તો શું એનાથી એ સાબિત નથી થતું કે આ વસીલો—(આ સંબંધ—આ માર્ગ) સદાના માટે જરૂરી છે ? અને તેને સદાય હાજર અને મૌજૂદ રહેવું જોઈએ ?

ખુદા તથાલાની મદ્દનો વસીલો : દલીલ ૩ :

ખુદા તથાલાએ, જે પોતે સર્વ વસ્તુઓથી પવિત્ર અને ઉચ્ચ છે, પોતાની ખૂલ જ વધારે રહેમત વડે દીન અને દુનિયાનાં સર્વ કામોના માટે વસીલાઓ (સાધનો) અને માર્ગો પૈદા કરી દીધા છે; અને દેખ કામોને પૂર્ણ કરવાને માટે તેણે એક જ કારગું નહીં પરસ્તુ કેટલાંય કારગું બનાવ્યાં છે. એ મહેરભાન જ્યારે પોતાના બંદાઓને કોઈ વસ્તુ અર્પણ કરવા ઈછે છે, તો પોતે સામે નથી આવતો અને ન કોઈને પોતાની પાસે બોલાવીને નવાજીશ કરે છે, બલ્કે તે કોઈ કારગું અને સંબંધ (વાસ્તો અને વસીલો) બનાવીને મહેરભાની કરે છે; અને જ્યારે કોઈ વસ્તુ બંદાઓ તરફથી કબૂલ કરે છે, તો તે પગું વસીલાથી જ કબૂલ ફરમાવે છે; અને ફક્ત અક્ષલવાળાઓ જ આ વાત જાણે છે.

હવે આપણે અહીં એક મહત્વનો ક્રોયડો (સવાલ) સામે રાખીને વાત કરીએ છીએ; અને તે છે પવિત્ર કુરાનનું આ શિક્ષણ (કુરાનની આ દોરવાળી) કે “ઇન્દ્રાયક નઅબ્દુ વ ઇન્દ્રાયક નસ્તાઈન—(ખુદાયા, અમો તારી જ ઈબાદત કરીએ છીએ અને તારથી જ મદ્દ માગીએ છીએ) એ પવિત્ર દુઆમાં સવાલ એ

છ કે શું આ પવિત્ર (શુદ્ધ) મદ્દ કે જે આપણે ખુદા તથાલા પાસેથી માગવી જોઈએ, તે ક્રોઈ (સાધન) વસીલા વગર શક્ય છે અથવા એ આ ઈસ્લામ દીનના સામાન્ય કાયદા મુજબ વાજબી હોઈ શકે છે ? જો તેનો જવાબ એ હોય કે આ વિનંતી સહિતની મદ્દની માગણી એ જ છે કે જે ઈસ્લામમાં છે, જેના વ્યવહારુ (અમલમાં હોવાના) પ્રકારનો ઉદ્દેશ કુરાનમાં મૌજૂદ છે; અને તે એ છે કે મોમિન બંધાએ રસૂલ (સ.અ.સ.) (૮ : ૮૮) અને સબર અને સલાત (દુઆ) (૨ : ૧૫૭)ના મારક્ષત ખુદા તથાલા પાસે દુઆઓ માગવી કે જેથી પરવરદિગારે આત્મ પોતાની રીત (સુન્નત) મુજબ ક્ષરિંઠાઓ (૪૧ : ૩૦-૩૧) રૂહ (૫૮ : ૨૨) નબી (સ.અ.સ.) (૮ : ૧૦૩) અને વલી ઈમામ (પઃપઃપ)ના મારક્ષત તેની મદ્દ કરશે. ખુદા તથાલાની આદત સદ્ગ્યથી એવી જ રહી છે.

એ જાગું જોઈએ કે ખુદાના નિયુક્ત ક્રેતા રસ્તાઓ અને સાધનો વડે ખુદાની ઈબાદત કર્યી અને તેનાથી મદ્દ માગવી એ બિલકુલ ખુદાની એકતા—ખુદાના એકપાણા—ને માનવા બરાબર છે, તે શિર્ક નથી જ, કેમકે એ રસ્તાઓ તથા સાધનો ખુદાના જ છે, ખુદા સિવાય ક્રોઈ પારકાના નથી; અને શિર્ક તે છે કે જેમાં ખુદાની મરજી વગર ખુદા સિવાયની ક્રોઈ વસ્તુને (મદ્દ માગવા માટેનું) સાધન બનાવવું.

પવિત્ર કુરાનના શિક્ષાગમાંથી એક એ પણ છે કે “તમો સબૂરી અને (સલાત) દુઆના મારક્ષત ખુદાવંદી મદ્દ માગો.” (૨ : ૪૫) હવે જો ક્રોઈ અક્ષતવાળો એ બાબત ઉપર

ઉડાણથી વિચાર કરે અથવા જુએ તો તેને એ સત્ય ઘણી જલ્દી સ્પષ્ટ સમજાઈ જો કે સબૂરી, જેનો અહી ઉદ્દેખ આવેલ છે તે માનવીનો એક ગુગુ છે, કે જે કોઈ સખ્ત કાર્યમાં અથવા કોઈ તકલીફ અને મુસીબતના વખતમાં મજબૂતી અને હિંમત વડે સખ્તી સહન કરવાને ક્રહે છે. એટલે કે ધીરજ અને સહનશીલતાની અસર અને ગુણની એ મહત્વતા છે કે ખુદાવંદ તથાલાથી મદ્દ માગવાના સાધન તરફ તેને નમાજ (દુઆ)ની સાથે સાથે એક સાધન ગાળાવવામાં આવ્યું છે. હવે તમે જ બતાવો કે સબૂરી અને (સલાત) નમાજ-દુઆના સાધન મારક્ષત ખુદાવંદી મદ્દ માગવામાં આવી તો શું એ રિક્ઝ છે ?

સબૂરી અને સલાતના આ જાહેરી અર્થ સિવાય તેની એ તાવીલ (ગૂઢાર્થ) પાગ કરવામાં આવેલ છે કે સબૂરી હજરત પથ્યગમ્બર સાહેબ (સ.અ.સ.) છે; અને સલાત આપ નામદારના વારસદારો (જાંતરિન) એટલે કે મૌલાના મુર્ત્જા અલી (અ.સ.) છે. એ જ નામદારો-માનવંતોના મારક્ષત ખુદા તથાલાથી મદ્દ માગવી જોઈએ; અને એ માટે જ હુકમ દેવામાં આવ્યો છે અને આ રીત જ સર્વર્થી ઉત્તમ છે.

Knowledge for a united humanity

સલ્વાત : દલીલ ૪ :

પદ્ધતિ આયતનો તરજૂમો : “તે ખુદા એ જ છે કે જે પોતે અને તેના કૃતિતા તમારા ઉપર દર્દ (સલ્વાત-આશીર્વાદ) મોકલે છે કે જેથી તે તમને (નાકરમાનીના) અંધકારમાંથી કાઢીને (ઇમાનના) પ્રકાશમાં લઈ

અપે." (૩૩ : ૪૩)

કુરાનની એક અન્ય આયતમાં ફરમાવેલું છે કે, "અને જેઠ ગામડીયા (બદ્ધુઓ) તો એવા પાગ છે કે જે ખુદા તથા આભરત (ક્ષયાભત) પર ઈમાન રાખે છે; અને જે કઈ ખર્ય કરે છે તેને (ખુદાના દરબારમાં) અદ્વાહની નજીદીકી તથા રસૂલ (સ.અ.સ.)ની દુઆઓ (આરીવિદ્યિ)નું સાધન સમજે છે. જાણી લ્યો કે (તે ખર્ય કરવું) જરેખર ચોક્કસપાડો તેમના માટે (અદ્વાહની) નજીક થવાનું કારણ બનશે. અદ્વાહ તેઓને બહુ જ જરૂરી પોતાની રહેમતમાં દાખલ કરી દેશો." (૮ : ૮૮)

આ બન્ને આયતોમાં એ કલ્પના અને અસર દેવામાં આવ્યા છે (એવો ભાવાર્થ દેવામાં આવ્યો છે) કે ખુદા તથાલાની છિદ્યાયત તથા રહેમતના પ્રકારને (રીતને) સમજી દેવામાં આવે કે કેવી રીતે મોમીનોને છિદ્યાયત તથા રહેમત પહોંચાડવામાં આવે છે. જ્યારે કે (આ રીત)–આ પ્રકાર–એવો છે કે અંધકારમાંથી કાઢીને પ્રકાશ તરફ આવવા અને ખુદાની નજીદીકી પ્રામ કરવામાં અદ્વાહ તથાલાના પદ્ધી કૃસિતા અને રસૂલ મદ્દ કરી શકે છે, તો શું આપાગું એ માન્યતા, એ કલ્પના અને જ્ઞાન આપાગું અંદર એ ભાવ, એ લાગાગું નથી રાખતા કે આપાગે મદ્દ અને રહેમત મેળવવા માટે આ (અદ્વાહ તથાલાના પદ્ધી મદ્દ કરનારા) સાધનો પાસે રજૂ થતા રહીએ–તેમની પાસે માગાગું કરતા રહીએ ? અને શું જેઓ મદ્દ દઈ શકે છે અને મદ્દ દેવા માટે ખુદાના તરફથી નિયુક્ત થયેલ છે તો તેમને "મદ્દ કરો" અથવા "મદ્દ દયો" એમ

કહેવું ખોટી વાત છે ? (ગેર વ્યાજબી વાત છે ?) સુભાનઅદ્ધાહ ! યાદ રહે કે જો જહેરમાં ફરિથતા અલગ અને રસૂલ (સ.અ.સ.) તથા ઈમામ (અ.સ.) જુદા છે, પરંતુ બાતિનમાં ફરિથતાઓ, પયગમબર (અ.સ.) તથા ઈમામ (અ.સ.)ના નૂરથી જુદા નથી.

(રહુલ કુદ્દસ) પવિત્ર રૂહ પાસેથી મદ્દ : દલીલ ૫ :

કુરાને હકીમમાં તમોને એવી ધર્મથી આયતો મળશે કે જેમાં એમ જગ્યાવવામાં આવેલ છે કે, ખુદા તથાલા પોતાના ખાસ બંદાઓને પોતાની એક ખાસ રૂહના મારફત મદ્દ દ્યે છે. આ માટે ખાસ કરીને કુરાનમાં જુઓ (૨ : ૮૭, ૨ : ૨૫૩, ૫ : ૧૧૦, ૧૬ : ૧૦૨, ૫૮ : ૨૨) આમાંથી પ્રથમ પ્રાગ ઠેકાગે એ ઉદ્દેખ આવેલ છે કે અદ્ધાહ તથાલા હજરત ઈસા અદૈહિસ્સલામને રહુલ કુદ્દસના મારફત મદ્દ કર્સો હો. ચોથા ઠેકાગે એમ જગ્યાવેલું છે કે હજરત રસૂલ (સ.અ.સ.)ના પવિત્ર દ્વિતીય (દ્વિતીય) ઉપર કુરાન એ જ પવિત્ર રહુલ કુદ્દસ મારફત નાન્જિલ થયું હતું; અને પાંચમી આયતમાં એમ ફરમાવવામાં આવેલ છે કે ખુદાઈ વેળાં એટલે કે હકીકી મોમિનોને પરયરદ્દિગારે આલમ પોતાની એક ખાસ રૂહ વડે મદ્દ દ્યે છે.

મારા વિચારે મુજબ અમુક વખતે સવાલ કરવો એ પ્રાગ ફાયદામંદ વાત હોય છે, કારણ કે તેમ કરવાથી વાત-બાબત-ખૂબ સારી રીતે મગજમાં બેસી જાય છે, માટે અહી મતલબની વાતને (કર્મની બાબતને) સવાલ અને

જવાબના સ્વરૂપમાં રજૂ કરવામાં આવી રહી છે કે શું એ કટ્ટપના વ્યાજબી છે કે પયગમ્બર (સ.અ.સ.)ના વસીતા વગર (હ. પયગમ્બરને વચ્ચમાં રહેનાર સાધન બનાવ્યા વગર) અદ્ધારી પાસેથી સીધેસીધી રૂહુલ કુદ્દસ અથવા કોઈ બીજી ખાસ રૂહ આવીને મોમિનોની મદ્દ કરે ? જોકે હજરત પયગમ્બર સાહેબ (સ.અ.સ.) સધળી આલમ (સધળી દુનિયાઓ)ના માટે ખુદાઈ રહેમત છે.

જવાબ : નહીં, એ વ્યાજબી નથી, એવી રૂહ (રહેમતે આલમ) હજરત પયગમ્બર સાહેબ (સ.અ.સ.)ના મારફત અને તેવાળ નામદારની દુઆના કારણે (વસીતાથી) આવે છે, બલ્કે એટલે સુધી ભેદ ખોલી દેવો જોઈએ કે (હુઝૂરે અનવર) હજરત મહુમદ પયગમ્બર સાહેબ (સ.અ.સ.) અદ્ધાર તાત્ત્વાલાની રહેમતના કેન્દ્ર છે અને રહેમતના શરિંતાઓ આપ નામદારની રહેમતના નૂરની કિરણો છે, કેમકે નૂરનું મૂળ (ઉદ્ભવ સ્થાન) જહેરી અને ભૌતિક સૂર્યની માફક નિર્જવ અને બે-અક્ષલ નથી હોતું બલ્કે તેમાં (મુક્દ્દસ) પવિત્ર રૂહ અને સંપૂર્ણ અક્ષલ હોય છે, જો એ નૂર કોઈ મોમિનના દિલમાં પ્રકાશ પાથરે છે (પ્રકાશ નાખે છે) તો તેમાં રૂહ અને અક્ષલના રજશુગ્દો મૌજૂદ રહેતાં હોય છે; અને એ સત્ય સિથિત વિષે કુરાનની (તન્જીલની) ભાષામાં કહેવામાં આવે છે કે, “એક ખાસ રૂહ વડે કે જે ખુદાના તરફથી હતી, તે મોમિન અથવા મોમિનોની મદ્દ કરવામાં આવી.”

આ પુસ્તકમાં જ્યાં જ્યાં શરિંતાઓના નાજિલ થવાથી

મોમિનોને મદ્દ કરવાનો ઉદ્દેશ આવ્યો છે, તેનો હરગીજ એવો અર્થ નથી કે નબુષ્ટત અને ઈમામતના નૂરના વગર, તેનાથી અલગ રહીને આ કાર્ય થાય છે, બલ્કે એનો છેતુ એ જ છે કે જે ઉપર જગ્ગાવવામાં આવ્યો છે, કે ક્ષરિતાઓ અને રૂષેની ઐજ્યતા અને સાથે મળવું એ એક મહાન દરજજાવાળું કેન્દ્ર છે, જેનું નામ છે નૂરે મુહમ્મદી (મુહમ્મદ (સ.આ.સ.)નું નૂર) અને અંજ નૂર ખુદા તથાલાની નજીદીકીનું માન મેળવવાનો મરતબો ધરાવે છે, નહી તો અક્ષાહ તથાલા તો સ્થળ અને સમયની કલ્પનાથી જુદો, તેનાથી તદ્દન પવિત્ર અને મુક્ત છે એટલે કે, “વ અચ્યદહુમ બી રૂહીમીનુ”...(૫૮ : ૨૨)નો મતલબ છે કે ખુદાએ મુસ્તકા અને મુર્તજાના નૂર વડે મોમિનોની મદ્દ કરી.

ક્ષરિતાઓથી મદ્દ : દલીલ ૬ :

સુરહ આલે ઈમરાનની તેરમી રૂક્ખના ઇરમાનોમાંથી એક આ પાણાથી કે, “જો બદર (બદરના યુદ્ધ)ના ટાણે મુસલમાનોની મદ્દ અક્ષાહ તથાલાએ ક્ષરિતાઓ મારાક્ત કરી હો.” હવે આ કાર્ય ઉપર જરા ગંભીર ભાવે વિચાર કરીને પરિગ્રામ મેળવવું જોઈએ કે જો રૂહાની મદ્દ, એ ક્રોછ એવો ખાસ ગુણ છેત કે જે ખુદાવંદ તથાલાની પવિત્ર જીત સિવાય અન્ય ક્રોછ સાધન—અન્ય ક્રોછ રસ્તા થકી નહી થવી જોઈએ અથવા તો એ (રૂહાની મદ્દ) પવિત્ર અક્ષાહનું ક્રોછ ખાસ કાર્ય છેત કે જેમાં બીજાં ક્રોછને ભળવું ન જોઈએ—શરીક ન થવું

જોઈએ—તો પછી ક્રિસ્ટાઓ તેમાં હરગીઝ દ્યાલ ન કરત અને કુરાન એમ ન દરમાવતે કે ક્રિસ્ટાઓના મારક્ષત આ મદ્દ કરવામાં આવી, જ્યારે કે ક્રિસ્ટાઓ ખુદા નથી પાણ રબ્બુલ આલમીન જ ખુદા છે, પાણ જો માનવી સચ્ચાઈ—હીક્કન—તરફ ધ્યાન જ ન આપે તો તેના માટે શું ઈલાજ હોઈ શકે છે ?

આ જ ઉદ્દેશ સુરહ અન્ધાલની પ્રથમ રૂક્ષઅની છેવટમાં પાણ મૌજૂદ છે કે, આ યુધ દરમ્યાન મુસલમાનોને ક્રિસ્ટાઓ મારક્ષત સહાય અને મદ્દ દેવામાં આવી હતી અને બંને સ્થળોએ (એક વાત સામાન્ય છે) એક વાત મળતી આવે છે અને તે એ કે આમ કરવાથી હેતુ એ. હતો કે મુસ્લીમોના વેળાના દૃદ્યાની શાંતિ જળવાઈ રહે, એટલે કે આ મોજુંઝો—આ ચમત્કાર એ માટે હતો કે એક તો ક્રિસ્ટાઓની મદ્દથી તે વખતે વિજય પ્રાપ્ત થાય; અને બીજું એ કે એ જાણીને દિલની અંદર સાંત્વન મળી શકે કે રૂહાની મદ્દનાં એવાં સાધનો પાણ મૌજૂદ છે અથવા એ કે ચમત્કારિક—મોજુંજા જેવા—પ્રકારની શાંતિ હેય.

Knowledge for a united humanity

ક્રિસ્ટાઓનું મદ્દગાર થવું : દલીલ ૭ :

પવિત્ર આયતનો તરજુમો : “ચોક્કસ, જેમારો એમ કણું કે અમારો પરવરદિગાર અલ્લાહ છે, પછી તેઓ (છેવટ સુધી એ જ ભરોસા ઉપર) કાયમ રહ્યા તેમના ઉપર ક્રિસ્ટા (એ સંદર્ભો લઈને) ઊતરે છે કે તમો ડરો નહીં—ચિંતા ન કરો—અને ન તો

ઘેદ (અફ્સોસ) કરે અને ખુશખબરી સાંભળો તે સ્વર્ગની કે જેનો તમને વાયદે કરવામાં આવ્યો હતો. અમો (ખુદાના હુકમથી) દુનિયાની જીંગીમાં પાગ અને આજેરતમાં પાગ તમારા મદ્દગાર છીએ.” (૪૧ : ૩૧-૩૨)

આ, હિક્મત સભર આયત થકી એ સર્વ્યાઈ જહેર થઈ જાય છે કે (પરવરણિારે આલમની સંઘળી દુનિયાએના પાલનહારની આજાથી શરિષ્ટાઓ રૂહાની પ્રકારે મોમિનોને સહાય અને મદ્દ કરે છે, કારણ કે (હક સુખાના વ તાતાલા) અખાહ તાતાલા સર્વ શરતોથી મુક્ત-સંપૂર્ણ અને સ્વાધીન છે-સ્વતંત્ર છે. તેણે બંને દુનિયાનાં કાર્યોને ચલાવવાના માટે-કાર્યો પૂરાં કરવાના માટે-સાધનો-રસ્તાઓ પેદા કરેલા છે; અને દેરેક કાર્યના માટે એક વસીલો અથવા કેટલાય વસીલાઓ નિયુક્ત કરેલા છે. તે (અખાહ) ઈજન હુકમ ઈરમાવે છે અને જહેર તથા બાતિનનાં સંઘળાં સાધનો તથા વસીલાઓ કાર્ય કરે છે. આ રીતે રૂહાની તથા જીસ્માની મદ્દના માટે પાગ ખુદાએ સાધનો (વસીલાઓ) બનાવ્યાં છે, જેનાથી જે પાગ મદ્દ મળે છે તે ખુદાની મદ્દ કરેવાય છે, કારણ કે તેનો રસ્તો-તેનું સાધન તથા તેનો વસીલો ખુદાના તરફથી જ છે.

રસૂલ (સ.અ.સ.)ની હુઅા વડે મદ્દ : દલીલ ૮ :

કુરાનની પવિત્ર આયતનો તરજુમો : “(અધ્ય રસૂલ) તમો તેમના માલમાંથી સદ્કો લઈ લ્યો (જ્ઞાત લેતા રહો) કે જેથી તેના માર્ક્ષત તમો તેમને પાક અને પવિત્ર કરી દેશો અને

તેઓના માટે દુઆ કરો. બેશક (ચોક્કસપારો) તમારી દુઆ
તેઓના માટે દિલની શાંતિ (અંતરના સુખ)નું કારગ બને છે.”
(૮ : ૧૦૩)

અખાહ તથાલાના આ મુખારક ફરમાનથી બે મહાન
હિકમતો સ્પષ્ટ થઈ જાય છે. એક એ કે રસૂલુલ્હાહ
(સ.અ.સ.)ની ભલી દુઆથી દિલની (મનની) શાંતિ-સુખની
સ્થિતિમાં-(સંતોષની હાલતમાં) લોકોને રૂહાની મદ્દ મળતી રહે
છે, કારગ કે મનની શાંતિ (અંતરના સુખ)નું જ નામ મદ્દ છે;
અને બીજી હિકમત એ છે કે જ્યારે પાગ મુસલમાનોની મદ્દના
માટે ક્રિસ્ટના ઉત્તર્યા (નાજિલ થયા) તો એ આપ નામદાર
(સ.અ.સ.)ની મુખારક દુઆથી ઉત્તર્યા, કેમકે ક્રિસ્ટનાઓના
(નાજિલ થયા) ઉત્તરવા બાબત ફરમાવવામાં આવ્યું છે કે એનો
છેતુ મૌભિનોને શાંતિ (સંતોષ-સુખ) અપાવવાનો હતો; અને
અહીં એ ફરમાન છે કે દિલોની શાંતિનું મૂળ તો હુઝૂર સંસ્કૃત
(હજરત રસૂલુલ્હાહ)ની પવિત્ર દુઆ જ છે, તો આપણે એનો
અર્થ ખૂબ સારી રીતે સમજી ગયા કે જે રીતે ક્રિસ્ટનાઓ
નાજિલ થયા અને રસૂલ (સ.અ.સ.)ના અસહાયોને ચમત્કારિક
મદ્દથી જે સંતોષ-સુખ સાંપડ્યું તે સધણું હજરત પયગમ્બર
(સ.અ.સ.)ની મુખારક દુઆની બરકતથી હતું. કારગ કે દેછ
પ્રકાસ્ની હીકી શાંતિનું સાધન અને કારગ રહેમતે આલમ
(હજરત મહિમદ સ.અ.સ.)ની પવિત્ર દુઆ છે. આ માટે દલીલ
નંબર ૪, ૫ અને ૬ જોઈ જાવ. તો એ જાગાય છે કે હૃદયની
શાંતિ અને રૂહાની મદ્દનું મૂળ અખાહ પાકની આજાથી નબી

સાહેબ (સ.અ.સ.) છે; અને આપ નામદારના પછી આપની પવિત્ર આલમાંના બરહક ઈમામો પાગ પોતપોતાના સમયમાં એ જ દરજજા (એજ ઓફા) ઉપર છે.

ઈન્સાને કભિલ (સંપૂર્ણ માનવી)ની ઉપમા : દલીલ ૬ :

કુરાનની છિકમત સભર આયતનો તરજુમો : “(અધ્ય રસૂલ) તમો કહી દ્યો કે જો ધરતી ઉપર—(આ ભૂમિ ઉપર) ક્રિસ્ટાઓ હોત અને શાંતિપૂર્વક—આરામથી ચાલતા ઇસ્તા હોત, તો અમે તેમની પાસે ક્રિસ્ટાને જ રસૂલ બનાવીને મોકલતે.” (૧૭ : ૮૫)

ખુદાના આ ફરમાનનો ઈશારો એ છે કે આ જગતમાં એવા સંપૂર્ણ (સર્વજ્ઞાન સંપન્ન) અને સર્વ બાબતમાં નિપુણ માનવી પાગ આવતા રહે છે કે જેઓ (જીસ્માનિયત) શારીરિક રીતે માગાસ—ઈન્સાન—હોય છે, પાગ રૂહાનિયતની રીતે મલાયક કરેવાય છે. તેઓ પોતે પાગ દેખ પ્રકારે સુખી—સંતોષી હોય છે અને અન્યોને પાગ ખુદાની આજ્ઞા વડે સંતોષ—સુખ દઈ શકે છે. તેઓ ક્રિસ્ટાઓ અને માનવીની વર્ચ્યે સંપર્ક અને સાધન (વસીલા) રૂપે હોય છે કે જેથી તેઓ ખુદ તથાલાની રહેમતો અને બરજ્ઞતો વડે લોકોને મહૃ કરી શકે; અને એવો સંપૂર્ણ માનવી કે જે ક્રિસ્ટાઓના ગુરુઓ વડે સભર હોય છે, તે સૌથી પ્રથમ મહાન રસૂલ (સ.અ.સ.)ની પવિત્ર જાત છે (વ્યક્તિ છે) અને આપ નામદાર (સ.અ.સ.)ના પછી બરહક ઈમામો (અ.સ.) છે.

પયગમ્બર તરફથી મદ્દ : દલીલ ૧૦ :

રસૂલુદ્વાહ સંક્ષિપ્ત અવૈઠી વ આવેઠી વસ્તુમ જ્યારે પાગ લોકોને અદ્વાહ તાયાલાના હુકમ અને ફરમાન મુજબ પવિત્ર અને સાંશ કરી દેતા હતા (૨ : ૧૫૧) તો તેનો અર્થ એમ થયો કે આપ નામદાર (સ.અ.સ.) તેઓના ગુનાછેને રહ કરી દેતા (ગુનાછે નારા કરી દેતા) હાં, તો શું આપણો આ અર્થને—આ બાબતને—એ શબ્દોમાં રજૂ નથી કરી શકતા, જેમાં એમ કહેવાય કે હજાર પયગમ્બર સાહેબ (સ.અ.સ.) આ પ્રમાણે જ લોકોની રૂહાની મદ્દ કરતા હતા અને પોતાની મુખારક દુખાઓ વડે મોભિનોને દૃઢ્યની શાંતિ—સંતોષ—પહોચાડીને તેમની સહાય અને મદ્દ કરતા હતા ?

કેમકે ખુદા તાયાલા મોભીનોના દૃઢ્યની જે સ્થિતિને સંતોષ—શાંતિના નામથી યાદ કરે છે, તે સંપૂર્ણપણે શાંતિ જ હોય છે; અને તેમાં દેખ પ્રકારની મદ્દ મૌજૂદ અને પ્રાસ થયેલી હોય છે, એટલે એવા સંતોષ અને શાંતિમાં ભગજની (વિચારેની), સંસ્કારની (ખાસિયતની) અને રૂહાની દેખ પ્રકારની મદ્દ સમાયેલી રહે છે, માટે જો એમ માની લેવામાં આવે કે સાચા દીનની ન્યામત અવિનાશી (અનંત) છે, તેથી તે ન્યામત રસૂલુદ્વાહ (સ.અ.સ.)ના પછી પાગ પોતાના સ્થાને મૌજૂદ અને બાકી રહેલ તથા જેમની તેમ છે, તેને ઘેરેલાની જેમ જ સંપૂર્ણ રહેવાનું છે, તો પછી આપ નામદાર (સ.અ.સ.)ના વારસદારો (જાનશિન)માં પાગ એ ગુગુ હોવો જોઈએ કે તેઓ નીચે જગાવેલી આયતની સચ્ચાઈની સાબિતી બની રહે.

“ખુઝ મીન આમુવાલીહીમ સદ્ગન તુતાહીએ હુમ વ
તુજકીયહીમ બિહા વસ્ત્વહી અદૈહીમ ઈન્ના સલ્વાતકા
સક્નુલ્લાહુમ...” (૮ : ૧૦૩) “તમો તેમના માલમાંથી સદ્ગ્રી
લ્યો, જેના થકી-જેના વડે તમો તેઓને (ગુનાહેથી) પાક અને
પવિત્ર કરી દેશો અને તેઓના માટે દુઆ કરો. બેશક, તમારી
દુઆ તેમના માટે દિલની શાંતિનું કારણ છે.”

(નાસીર) મદ્દગાર : દલીલ ૧૧ :

નામદાર પયગમ્બર સાહેબ સલ્વાત્ખાહુ અલૈહી વ આલૈહી
વસ્ત્વમનાં અમુક પવિત્ર નામો અને ઈલ્કાબો એવા છે કે તેના
મતલભ તથા અર્થ દ્વારા સ્પષ્ટપણે જાહેર થાય છે કે, આપ
નામદાર (સ.અ.સ.) પોતાના લોકોના મદ્દગાર (હિમાયતી), હાથ
જાલનાર (સંભાળનાર) તથા સહાયક અને ટેકો આપનાર છે.

જેમકે પયગમ્બર સાહેબ (સ.અ.સ.)ના પવિત્ર નામ
‘નાસીર’ દ્વારા એ હકીક્ત સ્પષ્ટ થઈ જાય છે કે નાસીર
મદ્દગારને કહે છે; અને અહી આ શબ્દનો હેતુ છે રૂહાની અને
નૂરાની મદ્દગાર; અને આમ હોવામાં ક્રેચને શા માટે અજાયબી
પામવું જોઈએ, જ્યારે કે સરવરે કાયનાત-હજરત
પયગમ્બર-(સ.અ.સ.) સધળી દુનિયાના લોકોને માટે અદ્વાહ
પાકની સર્વ-પૂરેપૂરી-રહેમત છે; અને ક્રેચ માનવી અકલ અને
જ્ઞાન વડે વિચારે અને પૂછે તો તેને એ જગુશો કે રહેમત
એ ક્રેચ એક મહેરબાનીનું નામ નથી, બલ્કે તેમાં તો
સધળી-પૂરેપૂરી-મહેરબાનીઓ એકઠી થયેલી અને મળેલી છે

જેમાં મદ્દ નુસરત અને દસ્તગીરી પાગ છે; અને એ જ ક્રમાલિયતના ગુગોનો સંબંધ ઉચ્ચ ખાસિયત ધરાવનારા હ. અલ્લી (અ.સ.) અને તેમના વંશમાંથી આવનાર ઈમામો નામદારના પવિત્ર વ્યક્તિત્વ સાથે પાગ છે, માટે જો આપણે ‘યા અલ્લી મદ્દ’ ક્ર્ષા કરીએ તો તેમાં શું રંકા ઉદ્ભબી શકે છે. આપણે તેમ કરવામાં ખુદા અને રસૂલ (સ.અ.સ.)ની મરણના વિરુદ્ધ કોઈ વાત ક્ષાપિ નથી કહી, બલ્કે આપણે આમ કહેવામાં એવા સાધન-એવી બાબતની સામે રજૂ થયા છીએ કે જેમને અદ્વાહ તથા તેની રહેમતના રસૂલ (સ.અ.સ.)એ નિયુક્ત કરી દીધા છે.

LS

હાદી - હિદાયત કરનાર : દલીલ ૧૨ :

એ વાત સર્વેની જાળમાં છે અને એ હીકત દે઱ે જાણે ખબર છે કે હાદી હિદાયત કરનાર અથવા માર્ગ બતાડનારને ક્રે છે છે; અને એનો અર્થ છે લોકોને દીન-મગજબના રસ્તા ઉપર ચલાવનાર. જેમાં હાથ જાલવાની અને સહાયતાની કલ્પના સમાયેલી છે, કે કોઈ નબળો-અશક્ત મુસાફર ક્યારે ક્યારે એ વાતના માટે પાગ મોહાજ હોય છે કે તેનો માર્ગદર્શક તેનો હાથ જાલે-તેને મદ્દ કરે-અને તેને આશ્રય આપે-સહારે આપે અને ક્યારેક એની પાગ જરૂરત પડી જાય છે કે મુરીદ પોતાના મુર્શિદનો છેદે પકડીને-તેની પાછળા પાછળા-ચાલીને તેના આશ્રયમાં રહે. હવે એક નાનક્યે બાળક પાગ એ વાતને ખૂબ જ સહેલાઈથી સમજી શકે છે કે આ દ્રાષ્ટાંતમાં હાદીનો

અર્થ છે મદ્દગાર; કેમકે હિંદાયત પોતે જ સૌથી મોટી મદ્દ છે. શું એ પદી પાગ ક્રેંચ એમ કહી શકે છે કે ઈમામ (અ.સ.) કે જેનો લક્ખ ‘હાઈએ દીન’ છે, જ્યારે મોમિનોની હિંદાયત અને માર્ગદર્શન કરે છે અને તેમને તેમની ધરેલી મંજુલ તરફ આગળ અને આગળ વધારે છે, તે તેના એવા એ કાર્યમાં (એ કાર્યનું નામ) ક્રેંચ મદ્દ નથી ? ક્રેંચ હાથ આલવાનું નથી ?

ગમે તેમ હોય પાગ અમોને એ બાબતનો પાકો વિશ્વાસ છે કે જ્ઞાન અને હિંમત તથા પ્રગતિ અને હિંદાયત એ ખરા અર્થમાં મદ્દ જ છે, માટે ‘યા અલી મદ્દ’ કહેવામાં કાંઈ ખોટું નથી.

સરપરસ્ત અને મદ્દગાર : દલીલ ૧૩ :

પવિત્ર કુરાનની આયતનો તરજૂમો : “ઓ અમારા પાલનહાર, ક્રેંચ પાગ રીતે અમોને આ વસ્તીમાંથી કે જેના રહેવાસીઓ ધ્યાગા જાલીમ છે, અમને કાઢ (બહાર લઈ જા) અને તારા તરફથી ક્રેંચ અમારો સરપરસ્ત (હિમાયતી) બનાવ અને તું પોતે જ ક્રેંચને તારા તરફથી અમારો મદ્દગાર બનાવ.” (૪ : ૭૫)

આ પાક અને પવિત્ર કુરાનની કેળવાળીની સાંચ સાંચ સમજગુ-સ્પષ્ટ ખુલાસો-એ છે કે જે સરપરસ્ત અને મદ્દગાર અદ્ભુત તાત્ત્વાના તરફથી હોય, જેને સધળા જગતના પાલનગઠારે (પરવરણગઠારે) પોતે જ નિયુક્ત કરી દીઘો હોય તે

ભરહક છે—તે સાચો છે અને તે લોકોની સરપરસ્તી અને મદ્દ
કરી શકે છે, કારણ કે તેને ખુદાવંદ તથાલાએ જે કાર્ય કરવાના
માટે નિયુક્ત ક્રેલ છે તેને બજાવી લાવવા અને પુરું કરવા
માટેની શક્તિ પાગ અર્પણ કરી દીધી છે.

હવે, કેમકે એવી વ્યક્તિ—એવો માનવી—(રખબુલ
ઈજાન) ખુદાવંદ તથાલાની મિત્રતા—સહાય અને મદ્દનું જાહેરી
સ્વરૂપ હોય છે તે માટે આ ઉચ્ચ દરજજા ઉપર ક્રેંડ સામાન્ય
માનવી તો હોઈ નથી શકતો, સિવાય કે સંપૂર્ણ—પૂરેપુરું જ્ઞાન
ધરાવનાર—માનવીના, કે જે હજરત પયગમબર સાહેબ
(સ.અ.સ.)ની પવિત્ર જાત—મુખારક વંશમાંથી હોય અને આપ
નામદાસનો સાચો વારસદાર (જાંતશિન) એટો કે ઉચ્ચ મુકામ
રાજનાર ઈમામ હોય.

ખુદાના બુરુર્ઝ નામ : દલીલ ૧૪ :

ખુદાનું કરમાન છે : “૩ લિક્ષાલીલ અસ્માઉલ હુસના
કખાદજિદુ બિહા.” (૭ : ૧૦) અર્થ : અને સારાં સારાં નામો
ખુદાનાં જ છે તો એ નામો વડે ખુદાને યાદ કરો.

કુરાન મજ્જીદમાં અહીં (૩૫૨) ઉલ્લેખવામાં આવેલી
આયત સિવાય ખુદાનાં નામોનો ઉલ્લેખ (૧૭ : ૧૧૦),
(૨૦ : ૮) અને (૫૮ : ૨૪)માં પાગ મૌજૂદ છે. “કોકબે
દુર્શ” પ્રકરણ ત્રીજું - મનકબત ૨૮માં મૌલાના અતી
અદૈહિસ્સલામનું મુખારક કરમાન છે કે, “અના અલ અસ્માઉલ
હુસના અક્ષતી, અમૃક્ષાદુન યુદુ આબિષી.” અર્થ : હું ખુદાના એ

સુંદર નામો ધૂં કે જેના વિષે ખુદાએ ફરમાવેલ છે કે તેમને તે નામો વડે યાદ કરવામાં આવે. આ વિષે વધુ વિગતના માટે શીયી તફસીરો અને તેના સંબંધી પુસ્તકો તપાસ કરી જોવામાં આવે.

એના સાથે સાથે અહીં કંઈક બારીક-નાજુક-વાતો પાગુ દેખાડવામાં આવે છે કે જે રીતે ઉપર જગ્ગાવેલી પવિત્ર આયતનો હેતુ છે કે ખુદાનાં સારાં-સુંદર અને બુર્જુર્ણ નામોની ઓળખાણ હેવી જોઈએ; કેમકે હજાત અમીરુલ મોમનીન અલી અદૈહિસલામ તાવીલ-(ગુરૂર્થ, ઉડી સમજ)ના માલિક છે, તેમણે સમજાવ્યું છે-ખુલાસો કર્યો છે-કે તેઓ ખુદાના મહાન (બુર્જુર્ણ) નામ છે, તેનો હેતુ એ છે કે સૌથી પ્રથમ સ્વુલ્દ્વાહ (સ.અ.સ.) પછી અલી (અ.સ.) પછી ઈમામો (અ.સ.) એટલે કે અલી (અ.સ.)ની ઓલાદ પોતપોતાના સમયમાં તેવાં નામો છે. આમ એ જ માનવંત સાહેબોને સુંદર નામો ગણુાવીને તે એક (અજોડ) (વાહીદ) ખુદાને યાદ કર્યો જોઈએ કે જેથી સર્વ જગતનો પાલનહાર (પરવરાદિગારે આલમ) આપણી પુકાર-અવાજને સાંભળે અને તે કબૂલ કરવાનું સદ્ભાગ્ય અર્પણ કરે.

Knowledge for a united humanity

નાસીરિ સ્વુલ (સ્વુલનો મદ્દગાર) : દલીલ ૧૫ :

“કાલ નબીઓ સહી અદ્ધારુ અલીહી વ આવે વસ્સાદ્ધમ રાયતુ લયલતન ઉસ્સી બી મુસબીતન અલા સાકીલ અર્ણી ગ્રસ્તુ જન્મત અદ્દીન મુહમ્મદીન સીક્ષાતી મીન ખલ્દી

અય્યદ્ધનુહુ બી અલીધીન." તરજુમો : 'હુલીયતુલ ઓલીયા' માં જગ્યાવ્યા મુજબ અબુલ હમરાથી આ રીવાયત પ્રખ્યાત છે કે ખુદાના સ્થળે ફરમાવેલ છે કે, જ્યારે શબે મેઅરાજના મને આસમાન ઉપર લઈ ગયા, તો આસમાન (અર્થ)ના નીચલા ભાગ ઉપર લખેલું જોયું "હું કે જે ખુદાવંદ દ્યું મે અદનની જન્નત કે જેમાં જુદી જુદી કેટલીય જાતનાં-કેટલાંય પ્રકાસના-વૃક્ષો લગાવેલ છે, મુહમ્મદ (સ.અ.સ.)ના માટે સર્જન કર્યા છે, કે જે મારી સર્જલી દેશેક વસ્તુઓ (મખ્લુકાત)માંથી પસંદ કરેલ છે અને ચૂંટી કાઢેલ છે. મે તેને અલીના માર્ખન મદદ આપી છે." (કિકબે દુર્ઘ - પ્રકરણ બીજું - મન્કબત નંબર ૫૩)

કુરાને પાકમાં જગ્યાવ્યા મુજબ, "વ કુર્રિબી અદખીલની મુદ્ભલ સીદ્ધીઓ ઉખરીજની મુખરજ સીદ્ધીઓ ઉજાહી મિક્ષદુંક સુલતાનનીસીર." (૧૭ : ૮૦) એટલે કે આપ નામદાર હઝરત મુહમ્મદ (સ.અ.સ.)ને ફરમાવવામાં આવેલ છે કે, "અને આ દુઓ માઝ્યા કરો, અય મારા પરવરણિાર, મને (જ્યાં પણ) પહોંચાડે સારે ઠેકાણો પહોંચાડ અને મને (જ્યાં પણ) કાઢ તો સારી રીતે કાઢ અને મને ખાસ પોતાની બારગાહમાંથી એક શક્તિશાળી મદદગાર દે." આ ફરમાન થકી જગ્યાય છે કે ઉપર ઉદ્દેખવામાં આવેલ હ્યાસ સંપૂર્ણપણે ખરી છે. (ફરમાન અલી દ્વારા ફરવામાં આવેલ કુરાનના તરજુમામાં ૧૭:૮૦ના માટે દ્શવિલ હાંસિયામાં તપાસી જુઓ.)

દીનને મહદ્ગાર : દલીલ ૧૬ :

પુસ્તક “કોકબે દુર્ભી” - પ્રકસણ બીજું - મન્જુબત
૧૪૫માં છે કે, “કાલનલબીએ સાહી અલ્લાહુ અલોહી વ આલોહી
વસ્સાખ્યમ ઈન્નાહ તઆલા, ઉભે હાજ્રાજીન બીઈલી વ અના
મિન્હુ વ ફીહ ઉન્નાલ ઉશમન કાન અલા બેનતીમીરિજબીહીલ
ઇહ.” તરજુમો : અબુગર ગજ્જારી રજીઅલ્લા અન્હે દ્વારા
રિવાયત છે કે રસૂલ (સ.અ.સ.)એ ઇરમાવ્યું : ખુદા તઆલાએ
આ દીનને અલી (અ.સ.)ના માર્કત રજી આપી છે અને હું
તેનાથી હું અને તેમની શાનમાં નીચે મુજબની આયત નાજિલ
થઈ છે : “ઉફ્મીન કાન અલા બેયનતીન.....અલ ઝ્ક.”

સ્યુલ (સ.અ.સ.)ના સાહી : દલીલ ૧૭ :

મુખ્યારક આયતનો તરજુમો : “અને તે લોકો જેઓ
કાશર થઈ ગયા, કહે છે કે તુ (અલ્લાહ તઆલાનો) મોકલેલ
નથી; (અય રસૂલ અ.સ.) તમો કહી દ્વ્યો કે મારી અને તમારી
વચ્ચે સાહી આપનાર અલ્લાહ તઆલા પૂરતો છે; અને તે
(શાખ્સ પાગ) કે જેની પાસે પુસ્તકનું સંપૂર્ણ જ્ઞાન છે.”
(૧૩ : ૪૩) અને બીજી કુરાનની આયત (જેનો ઉલ્લેખ ઉપર
થઈ ચુક્યો છે)નો તરજુમો આ છે કે, “શું કુરાનનો મુન્તીર
(ઈન્કાર કરનાર-કબૂલ ન કરનાર) એવા શાખ્સની બરોબરી કરી
શકે છે જે કુરાન ઉપર કાયમ છે, કે જે તેના રજ્બ-પાલનહારના
તરફથી આવેલ છે અને તેનાથી જ એક સાહી પાગ છે.”
(૧૧ : ૧૭)

હે જ્યારે કે આ બંને આયતો સંબંધે એ હીકાન
 સૂર્ય કરતાં પણ વધુ સાક્ષ છે કે એ મૌલાના અલી
 અલૈહિસ્સલામની શાનમાં છે, કે આપ માનવંત (અ.સ.) જ
 હારત રસૂલ (સ.અ.સ.)ની રિસાલત અને નબુવ્યતના બીજા
 સાક્ષી છે; અને ખુદાવંદ તથાલા ને હુકમનો પહેલો સાક્ષી છે;
 અને જે શખ્સ સદ્ભાગી છે અથવા ધર્માનુસાર ચાલનાર,
 ખુદાના હુકમને માનનાર છે તે આ બિંદુ ઉપર-આ વિષય ઉપર
 ખૂબ વિચાર કરીને એ સમજી લેશે કે અંભિયાઓના સરદાર
 (સ.અ.સ.)ની નબુવ્યતના સાક્ષી હોવાનો શું અર્થ છે.
 સુખહાનઅખાહ ! જગતના પાલાગહાર (પરવરણિગારે આલમ)એ
 અલી મુર્ત્જા (અ.સ.)ને શબ્દ હાજર અને સાક્ષીના દ્યુપાયેલા
 અર્થમાં અથાગ-બેંદ એવા ભડારના માલિક બનાવ્યા છે.

આનો ટૂંકુમાં અર્થ એ થાય છે કે રહેમતુલ્લીલ
 આલમીનની નબુવ્યત કે જે ઈલ્મ અને હિક્મત, પ્રમાણિકતા
 અને હિદાયત તથા રૂહાનિયત અને નૂરાનિયતના ભેદોની એક
 મહાન એવી દુનિયા છે (અને જે આપ નામદાર (સ.અ.સ.)ની
 રૂહાની અને જીસ્માની જીદ્ગી ઉપર છ્યાયેલ હતી) તેના
 સંઘળા અહેવાલોથી હારત અલી અલૈહિસ્સલામ સારી પેઠ
 જાગુકાર હતા.

એથી વિસુદ્ધ, એ કામ તેમ શક્ય થઈ શકે છે કે ખુદા
 તથાલાએ નૂરાનિયતની જે ઊચાઈ ઉપર હારત પયગમ્બર
 (સ.અ.સ.)ના નબુવ્યત અને કુદસી અજાયબીઓના લેદના
 અનુભવો મુજબ જ્યાં પોતાને સાક્ષી ગગાવ્યો છે, ત્યાં ક્રેચ

એવા સામાન્ય માનવીને પાગ સાક્ષી બનાવે કે જોગે વ્યક્તિગત
રીતે સધળા બનાવોને ન જોયા હોય. બલ્કે અસલ હીક્કત એ
છે કે મુહુમ્મદ (સ.અ.સ.) અને અલી (અ.સ.) એક જ પવિત્ર
નૂરનાં બે શારીરિક રૂપ છે; અને એ અર્થ આગળ ઉપર દર્શાવિલ
આયતોમાંના શબ્દ “શાહીદુમ્મીનહુ”થી પાગ સ્પષ્ટ-જહેર છે.
અર્થાત અલી (અ.સ.) નબી (સ.અ.સ.)ની નબુવ્યતના સાક્ષી
એ રીતે છે કે તેઓ (હ. અલી અ.સ.) પોતે જ મહાન નબી
સાહેબ (સ.અ.સ.)ના પવિત્ર નૂરથી છે, જેમકે આપ નામદાર
(સ.અ.સ.)એ ફરમાવ્યું છે કે, “અમે લોકો (અર્થાત હું અને
અલી) અદ્વાહની પાસે એક નૂરના સ્વરૂપે મૌજૂદ હતા...અલી
મારાથી છે અને હું અલીથી દું.”

ઉપર ઉદ્દેખવામાં આવેલ હીક્કતો અને મારફતો
(સરચ્યાઈઓ)ના પ્રકારામાં આપ પોતે જ હજ તથા ઈ-સાફ્થી એ
જગ્ગાવો કે જે સંપૂર્ણ માનવી ખુદાવંદની નજીદીકીના એ ઉચ્ચ
સ્થાન ઉપર બિરજમાન હોય, જે હાદીએ બરહક ખાતેમુલ
અંબિયાના પવિત્ર નૂરનો ભાગ હોય અને જે મહાન ઈમામના
આસમાની પુસ્તકના જ્ઞાન અને હિક્મત ધરાવનાર તથા નબુવ્યત
અને રિસાલતનો હમેશાનો સાક્ષી હોય, તે દેરકે પ્રકારથી મદ્દગાર
પાગ હોઈ શકે છે કે નહીં ?

ખુદાની મદ્દ કરો : દલીલ ૧૮ :

ખુદાવંદનું ફરમાન છે કે, “યા અધ્યુહ્ખ્યાજીના આમનુ
ઈન્તનસુરુ. વદ્ધાદ યન્સુર્કુમ વ યુસુબ્ભીત અકદામકુમ.”

(૪૭ : ૭) અર્થ : હે ઈમાન લાવનારાઓ ! જો તમો અખાહની મદ્દ કરશો તો તે તમારી મદ્દ કરશો અને તમારા પગ જમાવી શે.

આ પવિત્ર આયત દ્વારા થોડી મહાન છિકમતો જહેર થાય છે. પહેલી છિકમત એ છે કે મદ્દ ખાસથી ખાસ પાગ છે અને સામાન્યથી સામાન્ય પાગ; માટે આપણે ખુદા તથાલાના પછી રસૂલ (સ.અ.સ.)થી અને ઈમામ (અ.સ.)થી મદ્દ મારી શકીએ છીએ. અગર જો આ કામ એવું હોત તો અખાહ તથાલા મદ્દને સામાન્યપાણાની તરફ લાવીને એ ન કરમાવતે કે જો તમે ખુદાની મદ્દ કરશો તો ખુદા તમારી મદ્દ કરશો. માટે સ્પષ્ટ છે કે મદ્દ ક્રોઈ એવો ખાસ શર્જ નથી જે કષણ અને કષણ ખુદા તથાલાના માટે જ સંબોધવામાં (કહેવામાં) આવે.

બીજી છિકમત એ છે કે જે રીતે પયગમબર અને ઈમામ પોતાની નૂરાનિયતમાં મોભિનોની મદ્દ કરે છે, એ જ રીતે ઈમાન રાજનારાઓ (ઈમાનવાળાઓ)ને માટે જરૂરી છે કે તેઓ પોતાની જીસ્માની હેસિયતમાં રસૂલ (સ.અ.સ.) અને ઈમામ (અ.સ.)ની મદ્દ કરે, તેમને એનો બદલો અને તેનું કષણ બિલકુલ તે જ રીતે દેવામાં આવશે, જે રીતે તેઓએ ખુદાની મદ્દ કરી હોય, કેમકે ખુદા પોતે જાતે ક્રોઈ મદ્દનો મોહતાજ હરગીજ નથી.

ત્રીજી છિકમત એ છે કે જ્યારે તમે ખુદાના ખલીઝાની મદ્દ કરો છો, તો સમજો કે તમોએ ખુદાની મદ્દ કરી;

અને જ્યારે તે તમારી મદ્દ કરે છે, તો માનો કે તે ખુદાના તરફથી છે.

ચોથી હિકમત, પયગમ્બર અને ઈમામ અદૈહિમુસ્સલામનો મહાન દરજજો એ વાતથી ક્યારેય ઓછો નથી થતો કે તમો મોભિનો તેમની મદ્દ કરે છે. જેમ અલ્ફાઝ તઆલાની મદ્દ કરવાની કલ્પનાથી તેની (અલ્ફાઝની) મહાનતા અને તેના જલાલમાં ક્રોછ શંકા ઉદ્ભવી નથી શકતી.

પાંચમી હિકમત, ખુદા તઆલાનો આ હુકમ સામાન્ય નથી પરંતુ ખાસ છે, કેમકે જે હુકમ સામાન્ય હોય તેમાં અગર તો દ્રોગખથી ડરાવવામાં આવે છે અથવા બહેશ્તની આશા-ઉમેદ દેવરાવવામાં આવે છે, પણ આમાં એવું નથી, બલ્કે (પરખરણિારે આલમ) સર્વ જગતના પાલાગહારે મહેરબાનીની ઉચ્ચતાથી આ હુકમ એવા સ્વરૂપમાં જાહેર કરમાવેલ છે કે જેમ તેના ક્રોછ રોકાઈ ગયેલા કામમાં મદ્દ કરીને તેના ઉપર ઉપકાર કરવામાં આવેલ હોય; અને એ દીની જિદમત તથા તાબેદારીની મહત્વતા તથા મોટાઈનું વાર્ગન કરવાનો છેલ્લો દરજજો છે.

છી હીકમત, આમાં (પ્રગતિ) ચક્કી અને પડીનું ધોરણ બતાવવામાં આવ્યું છે કે જો ક્રોછ મોભિન નિયત, વયન અને અમલ (કાર્ય)ની સુધારણા નથી કરી શકતો અને ઈસ્લામના માર્ગ તથા રૂહનિયતના સસ્તામાં આગળ નથી વધી શકતો અને વારંવાર તેના પગ લથડી પડતા હોય, તો એ જાણવું જોઈએ કે તે ખુદાની મદ્દ નથી કર્સો, તેથી ખુદા તેની

મદ્દ નથી કરી રહ્યો; અને તે જ કારણે તેના પગલાંમાં અસ્થિસ્તા આવી રહી છે.

અન્સાર : દલીલ ૧૮ :

કુરાની આયતનો તરજુમો : “પછી જ્યારે ઈસા (અ.સ.)એ તેમની તરફથી ઈન્કાર અનુભવ્યો તો તેમણે ઈરમાવ્યું કે, કોઈ એવા શાખ્સ પાણ છે જે મારા મદ્દગાર થઈ જાય ખુદાના વાસ્તે, હવારીઓ બોલ્યા કે અમો મદ્દગાર છીએ અદ્ધારું તથાતાના.” (૩ : ૫૧)

કુરાની આયતનો તરજુમો : “ઓ ઈમાન લાવનારાઓ, તમો અદ્ધારું તથાતાના મદ્દગાર થઈ જાઓ, જેમ કે હ. ઈસા (અ.સ.) બિન મરીયમે હવારીઓથી કષ્ટું કે, અદ્ધારુના વાસ્તે મારે કોણ મદ્દગાર થાય છે ? ત્યારે હવારીઓ બોલ્યા, અમો અદ્ધારુના મદ્દગાર છીએ.” (૬૧ : ૧૪)

આ બંને આયતોનો ખુલાસો એ છે કે જે લોકો ખુદાની મદ્દ કરવા ઈચ્છા હોય તેઓ હજસત રસૂલુલ્લાહ (સ.અ.સ.)ની મદ્દ કરે; અને જેઓ રસૂલે બરહક (સ.અ.સ.)ની મદ્દ કરવા ઈચ્છા હોય, તો તેઓ જમાનાના ઈમામ (અ.સ.)ની મદ્દ કરે કે જેથી તેમને ખુદા અને રસૂલ તથા ઈમામ (અ.સ.)ની મદ્દ મળતી રહે કે જે જહેરી અને બાતિની છિદ્યાયતના સ્વરૂપમાં પ્રામ થતી રહેશે, જેના પરિગ્રામે તેઓ ઈન્સાની (માનવીય) શક્તિઓનું મૂળ (અસલ શક્તિ) બની જશે; અને તેમને બંને જગતોની સંઝળતાનાં સાધનો પ્રામ થરો.

ચેશની (પ્રકાશ) વડે મદ્દ : દલીલ ૨૦ :

મુખ્યાક આયતનો તરજુમો : “(અને તે એ દિવસ હો) જે દિવસે મુનાઝિક (ખુદાને ન માનનારા) પુરુષો અને સ્ત્રીઓ, ઈમાનવાળાઓને કહેશો (થોડી) અમારી વાટ જુઓ (થોડાક અમારા માટે થોલો) કે જેથી અમે પાગ તમારા નૂરથી કંઈક પ્રકાશ મેળવી લઈએ. તેમને જ્યાબ દેવામાં આવશે કે તમો પોતાના પછ્યાડે (આર્સના ઈતિહાસ અથવા દુનિયામાં) ફરી જાઓ (પાછા વળી જાઓ) પછી (ત્યાંથી) પ્રકાશની શોધ કરો.” (પ૭ : ૧૩)

આ આયત ઉપર છિકમતનાં ઘાગાં પાસાં છે, જેના વડે પ્રકાર પ્રકારની છિકમતોની અલક નજરે પડે છે. વળી એમાં એમ પાગ છે કે કોઈ શખ્સ ઈતિહાસના રસ્તે પાછે જઈની હજરત રસ્તુલ (સ.અ.સ.)ના જાંનશિન (વારસદાર)ને ઓળખી લ્યે; અને એમ પાગ છે કે મોભિનો જે નૂરના પ્રકાશ (રીશની)માં આખરત અથવા રૂહાનિયતના પંથ (રસ્તા)ની મુસાફરીમાં આગળ વધતા હો, તે એ જ નૂર હો જે તેઓની વચ્ચે દુનિયામાં પાગ હતું. એ માટે જ તેઓ મુનાઝિકને કહે છે કે તમો જો અમારી જેમ આ નૂરના પ્રકાશમાં ચાલવા ઈચ્છો છો તો દુનિયામાં પાછા જાઓ; અને ત્યાં નૂરની ઓળખ કરો અને બીજી એક ખૂબ જ સારી (વજન વાળી) વાત એમાં એ પાગ છે કે શું મુનાઝિક લોકો એ સ્થાન ઉપર (એ જગ્યાએ) માર્ગદર્શન, હાથ પકડવો અને મદ્દ માગવી, એ માટે નથી પોકાસ્તા ? (સાંદ નથી કરતા ?) અને શું તેમને એ જ્યાબ નથી મળતો કે

તમોને આજે અહી નૂર વડે કોઈ મદ્દ નહી મળશે, કારણ કે
તમોએ દુન્યવી જિંદગીમાં આ નૂરથી કોઈ મદ્દ મેળવી નથી ?
(તમોએ એ નૂરને ઓળખ્યો નથી).

સધળા મુસલમાન : દલીલ ૨૧ :

કેટલી ખુશીની વાત છે કે સધળા મુસલમાનો એક
ખુદા તથા રસૂલ (નબુવ્યત)માં વિશ્વાસ ધરાવવા બાબત એક
હેવા સિવાય અલી (અ.સ.)ની વિલાયત (દિસ્તી) વિષે પણ
એક રીતે જોતાં એક જ છે, એટસે કે જે દરજજા પર પણ
હેય, અલી (અ.સ.)ને હાદી તથા માર્ગદર્શક જરૂર માનવામાં
આવે છે. જ્યારે તેમની હિદાયત અને તેમનું માર્ગદર્શન
સર્વમાન્ય છે—(સધળાઓને કબૂલ છે) તો એ જ હિદાયત તથા
માર્ગદર્શન, દસ્તગીરી અને મદ્દ છે; અને તેનો અર્થ એ થયો
કે અલહુમુલિક્ષાહ, મુસલમાનો અલી (અ.સ.)ને મદ્દગાર અને
દસ્તગીર (હાથ આલનાર) માને છે. તેઓ જોકે આદત ન
હેવાથી (ટ્યાયેલા ન હેવાથી) “યા અલી મદ્દ” ઘણું ઓછું
બોલતા હો. અમોએ આ પુસ્તિકામાં વારંવાર એ ખુલાસો કર્યો
છુ કે જે હાદી છે (માર્ગદર્શક છે) તેજ મદ્દગાર પણ છે, જ્યારે
કે હિદાયત મદ્દ છે અને મદ્દ હિદાયત છે, એટસે કે આ બંને
શબ્દોનો અર્થ એક જ છે.

અનુવાદ : અકબર જીબ રાજન

તા. ૨૪ માર્ચ, ૧૯૮૮

તા. ૧૮ ડિસેમ્બર, ૧૯૯૨

2